

મઈ વ ઓરત દોનો કે લિયે મુફીદ રિસાલા



Zakhmi Saanp (Gujarati)

ઝખ્મી સાંપ

શીખે તરીકા, અમીરે અહલે સુખત, બાવિધે કાવતે ઉલ્લાખી, હઝરતે અલ્લામા મીલાના અબુ બિસાલ

મુહમ્મદ ઇલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી 

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
أَمَّا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

કિતાબ પઢને કી દુઆ

અઝ : શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી, હઝરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અતાર કાદિરી ર-ઝવી دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَهُ
દીની કિતાબ યા ઈસ્લામી સબક પઢને સે પહલે ઝૈલ મેં દી હુઈ દુઆ પઢ લીજિયે إِنَّ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ જો કુછ પઢેંગે યાદ રહેગા. દુઆ યેહ હૈ :

اللَّهُمَّ افْتَحْ عَلَيْنَا حِكْمَتَكَ وَأَنْشُرْ
عَلَيْنَا رَحْمَتَكَ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ

તરજમા : ઐ અલ્લાહ! છુમ પર ઈલ્મો હિક્મત કે દરવાઝે ખોલ દે ઔર છુમ પર અપની રહમત નાઝિલ ફરમા ! ઐ અ-ઝમત ઔર બુરુગી વાલે । (المستطرف ج ١، ص ٤١، دار الفكر بيروت)
નોટ : અવ્વલ આખિર એક એક બાર દુરુદ શરીફ પઢ લીજિયે.

તાલિખે ગમે મદીના

વ બકીઅ

વ મગિફરત

13 શવ્વાલુલ મુકર્રમ 1428 હિ.



ઝખ્મી સાંપ

યેહ રિસાલા (ઝખ્મી સાંપ)

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી હઝરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અતાર કાદિરી ર-ઝવી ઝિયાઈ દَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَهُ ને ઉદ્દૂ ઝબાન મેં તહરીર ફરમાયા હૈ.

મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી) ને ઈસ રિસાલે કો ગુજરાતી રસ્મુલ ખત મેં તરતીબ દે કર પેશ ક્રિયા હૈ ઔર મક-ત-બતુલ મદીના સે શાએઅ કરવાયા હૈ. ઈસ મેં અગર કિસી જગહ કમી બેશી પાએં તો મજલિસે તરાજિમ કો (બ ઝરીઅએ મક્તૂબ, ઈ-મેઈલ યા SMS) મુત્તલઅ ફરમા કર સવાબ કમાઈયે.

રાબિતા : મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી)

મક-ત-બતુલ મદીના, સિલેક્ટેડ હાઉસ, અલિફ કી મસ્જિદ કે સામને,
તીન દરવાઝા, અહમદઆબાદ-1, ગુજરાત, ઈન્ડિયા

MO. 9374031409 E-mail : translationmaktabhind@dawateislami.net

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
أَمَّا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

अप्पी सांप

शैतान लाभ सुस्ती दिलासे मगर आप येह रिसाला
(19 सफ़हात) मुकम्मल पढ लीजिये और षस की ब-र-कतें हासिल
कीजिये.

दुइद शरीफ़ की इज़ीलत

दो² जहां के सुल्तान, सरवरे जीशान, महबूबे रहमान
का फ़रमाने मज़िफ़रत निशान है : मुज पर दुइद पाक
पढना पुल सिरात पर नूर है जो रोजे जुमुआ मुज पर अस्सी बार दुइद पाक
पढे उस के अस्सी साल के गुनाह मुआफ़ हो जाअंगे.

(أَلْفُزْدُوسُ بِمَأثورِ الْخُطابِ ج ٢ ص ٤٠٨ حدیث ٤٣٨١)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

दुअरते सख्यिदुना अबू सईद अुदरी عَنْهُ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ हैं :
अेक नौ जवान सहाबी عَنْهُ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ की नई नई शाही दुई थी. अेक
बार जब वोह अपने घर तशरीफ़ लासे तो देभा के उन की दुल्लन घर के
दरवाजे पर अडी है, मारे जलाल के नेजा तान कर अपनी दुल्लन की
तरफ़ लपके. वोह धभरा कर पीछे हट गई और (रो कर) पुकारी : मेरे
सरताज ! मुजे मत मारिये, मैं बे कुसूर हूं, जरा घर के अन्दर यल कर
देभिये के किस चीज ने मुजे बाहर निकाला है ! युनान्हे वोह सहाबी
عَنْهُ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ अन्दर तशरीफ़ ले गअे, क्या देभते हैं के अेक अतरनाक

ફરમાને મુસ્તફા ﷺ : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुझ पर एक बार दूड़ दे पाक पढा अदवाउ उस पर दस रउमतें बेजता है. (स्لم)

ઝહરીલા સાંપ કુંડલી મારે બિઘોને પર બૈઠા હૈ. બે કરાર હો કર સાંપ પર વાર કર કે ઉસ કો નેઝે મેં પિરો લિયા. સાંપ ને તડપ કર ઉન કો ડસ લિયા. ઝખ્મી સાંપ તડપ તડપ કર મર ગયા ઓર વોહ ગૈરત મન્દ સહાબી صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ સાંપ કે ઝહૂર કે અસર સે જામે શહાદત નોશ કર ગએ.

(مسلم ص ۲۲۸ حدیث ۲۲۳۶ مُلَخَّصًا)

صَلُّوْا عَلَيَّ الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٌ

ગૈરત મન્દ ઈસ્લામી ભાઈયો ! દેખા આપ ને ? હમારે સહાબએ કિરામ عَلَيْهِمُ الرِّضْوَان કિસ કદર બા મુરવ્વત હુવા કરતે થે. ઉન્હેં યેહ તક ભી મન્જૂર ન થા કે ઉન કે ઘર કી ઓરત ઘર કે દરવાઝે યા ખિડકી મેં ખડી રહે. અપની ઝૌજા કો બના સંવાર કર બે પર્દગી કે સાથ શાદી હોલ મેં લે જાને વાલોં, બે પર્દગી કે સાથ સ્કૂટર પર પીછે બિઠા કર ફિરાને વાલોં, શોપિંગ સેન્ટરોં ઓર બાઝારોં મેં બે પર્દગી કે સાથ ખરીદારી સે ન રોકને વાલોં કે લિયે ઈબ્રત હી ઈબ્રત હૈ.

औरत पशु लुगा कर बाहर न निकले

મુસ્તફા જાને રહમત صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ફરમાતે હેં : બેશક જો ઓરત પુશબૂ લગા કર મજલિસ કે પાસ સે ગુઝરે તો વોહ ઐસી ઐસી હૈ યા'ની ઝાનિયા હૈ.

(ترمذى ج ۴ ص ۳۶۱ حدیث ۲۷۹۰)

મુફ્સિરે શહીર, હકીમુલ ઉમ્મત હઝરતે મુફ્તી અહમદ યાર ખાન عَلَيْهِ رَحْمَةُ الْحَنَّان ઈસ હદીસે પાક કે તહ્ત ફરમાતે હેં : ક્યૂંકે વોહ ઉસ પુશબૂ કે ઝરીએ લોગોં કો અપની તરફ માઈલ કરતી હૈ ચૂંકે ઈસ્લામ ને ઝિના કો હરામ કિયા ઈસ લિયે ઝિના કે અસ્બાબ સે (ભી) રોકા (હૈ).

(ميرآاتول مناجول، ج. 2، ص. 172)

करमाने मुस्तकी صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : उस शप्स की नाक पाक आवूद हो जिस के पास मेरा ठिक हो और वोह मुज पर दुइडे पाक न पढे. (ترمذی)

बे पर्दगी की डोलनाक सजा

उजरते सय्यिदुना ईमाम अहमद बिन हजर मक्की शाईह
 نكلك فرماتے हैं : मे'राज की रात सरवरे काअेनात,
 शाडे मौजूदात صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ने जो बा'ज औरतों के अजाब के
 डोलनाक मनाजिर मुला-हजा फरमाअे उन में येह ली था के अेक औरत
 बालों से लटकी हुई थी और उस का दिमाग भौल रहा था. सरकार
 صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ की भिदमते सरापा शफ़कत में अर्ज़ की गई के येह
 औरत अपने बालों को गैर मर्दों से नहीं छुपाती थी.

(الرَوَاجُ عَنِ اقْتِرَافِ الْكَبَائِرِ ج ٢ ص ٩٧-٩٨ مُلَخَّصًا)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

भौंफ़नाक जानवर

गाबिबन शा'बानुल मुअज़्ज़म 1414 सि.हि. का आभिरी
 जुमुआ था. रात को कोरंगी (बाबुल मदीना कराखी) में मुअकिद होने
 वाले अेक अजीमुशशान सुन्नतों लरे ईजतिमाअ में अेक नौ जवान से
 सगे मदीना غُفِي عَنْهُ (राकिमुल हुइफ़) की मुलाकात हुई. उस पर भौंफ़
 तारी था, उस ने हलफ़िया बयान दिया के मेरे अेक अजीज की जवान
 बेटी अयानक झैत हो गई. जब हम तदफ़ीन से फ़ारिग हो कर पलटे
 तो मर्दूमा के वालिद को याद आया के उस का अेक हेंड बेग जिस में
 अहम कागजात थे वोह ग-लती से मय्यित के साथ कभ्र में दफ़न हो
 गया है. युनाच्ये ब अम्रे मजबूरी दोबारा कभ्र फोदनी पडी, जूं ही हम
 ने कभ्र से सिल हटाई भौंफ़ के मारे हमारी खीषें निकल गई क्यूंके जिस
 जवान लडकी को अलमी अलमी हम ने सुथरे कफ़न में लपेट कर सुलाया था

करमाने मुस्तकः: عَلَى اللَّهِ تَعَالَى غِيُورٌ وَعَلَى اللَّهِ تَعَالَى غِيُورٌ وَعَلَى اللَّهِ تَعَالَى غِيُورٌ
नाज़िल करमाता है. (ज़ुं.)

वोड कङ्कन फ़ाड कर उठ बैठी थी और वोड ल्मी कमान की तरड टेढी !
आड ! उस के सर के बालों से उस की टांगें बंधी हुई थीं और कई छोटे छोटे
ना मा'लूम भौङ्नाक जानवर उस से चिमटे हुअे थे. येड दड्शत नाक
मन्जर देभ कर भौङ् के मारे हमारी घिगगी बंध गई और हेंड बेग
निकाले भिगैर जूं तूं मिट्टी फ़ेंक कर हम भाग अडे हुअे. घर आ कर मैं ने
अजीजों से उस लडकी का जुर्म दरयाफ़्त किया तो बताया गया के उस में
कोई झी जमाना मा'यूब समजा जाने वाला जुर्म तो नहीं था, अलबत्ता
येड ल्मी आम लडकियों की तरड फ़ेशन अबल थी और पर्दा नहीं करती
थी. अल्मी इन्तिकाल से यन्ट रोज पहले रिश्तेदारों में शादी थी तो इस
ने फ़ेशन के बाल कटवा कर बन संवर कर आम औरतों की तरड शादी
की तकरीब में बे पर्दा शिर्कत की थी.

अै मेरी बहनो ! सदा पर्दा करो तुम गली कूयों में मत फिरती रहो
वरना सुन लो कभ्र में जब जाओगी सांप भिखू देभ कर चिल्लाओगी

कमजोर बहाने

क्या उस बढ नसीब फ़ेशन परस्त लडकी की दास्ताने गम निशान
पढ कर हमारी वोड इस्लामी बहनें दसें इभ्रत हासिल नहीं करेंगी जो
शैतान के उक्साने पर इस तरड के डीले बहाने करती रहती हें के मेरी
तो मजबूरी है, हमारे घर में कोई पर्दा नहीं करता, जानदान के रवाज
को ल्मी देभना पडता है, हमारा सारा जानदान पढा लिभा है, सादा
और बा पर्दा लडकी के लिये हमारे यहां कोई रिश्ता ल्मी नहीं भेजता.
बस दिल् का पर्दा डोता है, हमारी निय्यत तो साङ् है वगैरा वगैरा.
क्या जानदानी रस्मो रवाज और नफ़स की मजबूरियां आप को अजाबे
कभ्र व जहन्नम से नजात दिला देंगी ? क्या आप बारगाडे भुदा वन्दी

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالَى عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّمَ : جيس کے پاس میرا جیک لُہوا اور اُس نے مُوڑ پر دُرُہے پاک نہ پڑا تہذکیک
 વોહ બદ બપ્ત હો ગયા. (عَنْ)

میں ઈસ તરહ કી ખોબલી મજબૂરિયાં બયાન કર કે છુટકારા હાસિલ કરને મેં કામ્યાબ હો જાએંગી ? અગર નહીં ઓર વાકેઈ નહીં તો ફિર આપ કો હર હાલ મેં બે પદ્દગી સે તૌબા કરની પડેગી. યાદ રખિયે ! લૌહે મહફૂઝ પર જિસ કા જહાં જોડા લિખા હોતા હૈ વહીં શાદી હોતી હૈ. વરના આએ દિન કઈ પઢી લિખી મોડર્ન કંવારી લડકિયાં પલક ઝપકતે મેં મૌત કા શિકાર હો કર રહ જાતી હૈં બલકે બા'ઝ અવકાત ઐસા ભી હોતા હૈ કે દુલહન અપની “રુખ્સતી” સે કબ્લ હી મૌત કે ઘાટ ઉતર જાતી હૈ ઓર ઉસે રોશનિયાં સે જગ-મગાતે, ખુશબૂએં મહકાતે હ-જ-લએ અરૂસી મેં પહોંચાને કે બજાએ કીડે મકોડોં સે લબરેઝ તંગો તારીક કબ્ર મેં ઉતાર દિયા જાતા હૈ.

તૂ ખુશી કે ફૂલ લેગી કબ તલક ?

તૂ યહાં ઝિન્દા રહેગી કબ તલક ?

صَلُّوْا عَلَی الْحَبِیْب ! صَلَّی اللہُ تَعَالَى عَلَی مُحَمَّدٍ

પયાસ સાઠ સાંપ

1986 સિ.ઈ. કે જંગ અખ્બાર મેં કિસી દુખ્યારી માં ને કુછ ઈસ તરહ બયાન દિયા થા : મેરી સબ સે બડી લડકી કા હાલ હી મેં ઈન્તિકાલ હુવા હૈ, ઉસે દફન કરને કે લિયે જબ કબ્ર ખોદી ગઈ તો દેખતે હી દેખતે ઉસ મેં પયાસ સાઠ સાંપ જમ્મ હો ગએ ! દૂસરી કબ્ર ખુદવાઈ ગઈ ઉસ મેં ભી વોહી સાંપ આ કર કુંડલી માર કર એક દૂસરે પર બૈઠ ગએ. ફિર તીસરી કબ્ર તય્યાર કી ઉસ મેં ઉન દોનોં કબ્રોં સે ઝિયાદા સાંપ થે. સબ લોગોં પર દહ્શત સુવાર થી, વક્ત ભી કાફી ગુઝર ચુકા થા, નાચાર બાહમ મશ્વરા કર કે મેરી પ્યારી બેટી કો સાંપોં ભરી કબ્ર મેં દફન કર કે

करमाने मुस्तफ़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुज पर सुब्ब व शाम दस दस बार दुरुदे पाक पढा उसे क्रियामत के दिन मेरी शफ़ाअत मिलेगी. (अबुअरुफ़)

लोग दूर ही से मिट्टी फेंक कर चले आये. मेरी मर्दूमा बेटी के अब्बाजान की कब्रिस्तान से मकान आने के आ'द डालत बहुत पराब लो गँ और वोड षौफ़ के मारे बार बार अपनी गरदन जटकते थे. दुप्यारी मां का मजीद बयान है के मेरी बेटी यूं तो नमाज व रोज़ा की पाबन्द थी मगर वोड इशान किया करती थी. मैं उसे महब्बत से समजाने की कोशिश करती थी मगर वोड अपनी आबिरत की त्वाँई की बातों पर कान धरने के बजाये उलटा मुज पर बिगड जाती और मुझे जलील कर देती थी. अइसोस मेरी कोई बात मेरी नादान मोडर्न बेटी की समज में न आई.

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

षौफ़नाक गढा

डो सकता है शैतान किसी को वस्वसा डाले के येड अब्बारी वाकिआ है क्या मा'लूम येड सय्या ली है या नहीं? बिलफ़र्ज येड गलत डो ली तो गैर शर-ई इशान परस्ती और बे पर्दगी का ज़र्रड डोना ली तो कोई साबित नहीं कर सकता. हदीसे पाक में ना ज़र्रड इशान का अज़ाब मुला-डज़ा इरमाईये. सरकारे मदीना صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ का इरमाने इब्रत निशान है : मैं ने कुछ लोग औसे देखे जिन की ખालें आग की कैंचियों से काटी जा रही थीं. मेरे इस्तिफ़सार पर बताया गया, येड वोड लोग हें जो ना ज़र्रड अश्या से जीनत हासिल करते थे. और मैं ने अेक गढा ली देखा जिस में से यीषो पुकार की आवाज़ें आ रही थीं. मेरे दरयाफ़्त करने पर बताया गया, येड वोड औरतें हें जो ना ज़र्रड अश्या के जरीये जीनत किया करती थीं. (تاريخ بغداد ج ١ ص ١٠٥) याद रबिये ! नेल पौलिश की तड नापुनों पर जम जाती है लिडाजा औसी डालत में वुजू करने से न वुजू डोता है न

કરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّمَ : جس کے پاس میرا تیک لُہوا اور اُس نے مُوڑ پَر دُرُود شَرِیْک نہ پढا اُس نے جُکڑا کِی. (عہدِ اَزْمَن)

નહાને સે ગુસ્લ ઉતરતા હૈ, જબ વુઝૂ વ ગુસ્લ ન હો તો નમાઝ ભી નહીં હોતી.

ખબરદાર !

હરગિઝ હરગિઝ શૈતાન કે ઇસ બહકાવે મેં મત આઈયે. જૈસા કે બા'ઝ નાદાન લોગ ઇસ તરહ કહતે સુનાઈ દેતે હૈં કે દુન્યા તરક્કી કર ગઈ હૈ. مَعَاذَ اللّٰهِ عَزَّ وَجَلَّ ચાદર ઓર ચાર દીવારી તો ઇન્તિહા પસન્દ મુસલ્માનોં કા ના'રા હૈ, અબ તો મદોં ઓર ઓરતોં કો શાને સે શાના મિલા કર કામ કરના ચાહિયે વગૈરા. યકીનન એક મુસલ્માન કે લિયે કુરઆન કી દલીલ કાફી હોતી હૈ. લિહાઝા દિલ કી આંખોં સે કુરઆને પાક કી યેહ આયતે કરીમા પઢિયે :

وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ

تَبَرَّجِ الْجَاهِلِيَّةِ الْأُولَى

(પ ૨૨, અહઝાબ : ૩૩)

તર-જ-મએ કન્જુલ ઇમાન : ઓર અપને ઘરોં મેં ઠહરી રહો ઓર બે પદાં ન રહો જૈસે અગલી જાહિલિયત કી બે પદાંગી.

આયતે બાલા બાઝારોં ઓર શોપિંગ સેન્ટરોં મેં બે પદાંગી કે સાથ આને જાને વાલિયોં, ખુદ કો મખ્લૂત તફરીહ ગાહોં કી ઝીનત બનાને વાલિયોં, મખ્લૂત તા'લીમી ઇદારોં મેં તા'લીમ પાને વાલિયોં, સ્કૂલ યા કોલેજ મેં ના મહરમ ઉસ્તાદોં સે પઢને ઓર ના મહરમોં કો પઢાને વાલિયોં, દફતરોં, કારખાનોં, શિક્ષાખાનોં ઓર મુપ્તલિફ ઇદારોં મેં મદોં કે સાથ બે પદાં યા ખલ્વત (યા'ની તન્હાઈ) મેં યા અન્દેશએ ફિતના હોને કે બા વુજૂદ મિલજુલ કર કામ કરને વાલિયોં કો દા'વતે ફિક દે રહી હૈ.

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

ફરમાને મુસ્તફા ﷺ : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : જો મુઝ પર રોઝે જુમુઆ દુરૂદ શરીફ પઢેગા મેં કિયામત કે દિન ઉસ કી શકાઅત કરૂંગા. (جمع الجوامع)

બેટા ગયા તો ક્યા હુવા, હયા તો બાકી હૈ

બા હયા ખવાતીન ખ્વાહ કુછ ભી હો જાએ બે પદ્ગી નહીં કિયા કરતી જૈસા કે સચ્ચિ-દતુના ઉમ્મે ખલ્લાદ رَضِيَ اللهُ تَعَالَى عَنْهَا પદા કિયે મુંહ પર નિકાબ ડાલે અપને શહીદ ફરઝન્દ કી મા'લૂમાત હાસિલ કરને કે લિયે બારગાહે સરવરે કાએનાત صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ મેં હાઝિર હુઈ. કિસી ને કહા : આપ ઈસ હાલત મેં બેટે કી મા'લૂમાત હાસિલ કરને આઈ હૈં કે આપ કે ચેહરે પર નિકાબ પડા હુવા હૈ ! કહને લગી : “અગર મેરા બેટા જાતા રહા તો ક્યા હુવા મેરી હયા તો નહીં ગઈ.”

(سُنَنِ ابوداؤد ج ٣ ص ٩ حديث ٢٤٨٨ مُلَخَّصًا)

અલ્લાહ عزَّ وَّجَلَّ કી ઉન પર રહમત હો ઓર ઉન કે સદકે હમારી બે હિસાબ મગ્ફિરત હો.

أَمِين بِجَاهِ النَّبِيِّ الْأَمِين صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

બે પદ્ગી કોઈ છોટી મુસીબત નહીં !

ઈસ હિકાયત સે હમારી વોહ ઈસ્લામી બહને દર્સ હાસિલ કરેં કે જો બે પદ્ગી કે લિયે તરહ તરહ કે બહાને તરાશતી હૈં. કોઈ કહતી હૈ : ક્યા કરૂં મેં તો બેવા હૂં, કોઈ કહતી હૈ : બચ્ચોં કા પેટ પાલને કે લિયે દફતર મેં ગૈર મદોં કે સાથ બે પદ્ગી યા ખલ્વત (યા'ની તન્હાઈ) મેં યા અન્દેશએ ફિતના હોને કે બા વુજૂદ નોકરી કરની પડ ગઈ હૈ, હાલાં કે હુસૂલે મઆશ કે લિયે કોઈ ઘરેલૂ કરબ ભી મુમ્કિન થા, લેકિન “મ-દની સોચ” કહાં સે લાએ ! ક્યા પહલે કી બા પદા ખવાતીન બેવા નહીં હોતી થી ? ઉન પર મુસીબતેં નહીં પડતી થી ? ક્યા અસીરાને કરબલા رَضِيَ اللهُ تَعَالَى عَنْهُمْ પર આફતોં કે પહાડ નહીં ટૂટે થે ? ક્યા مَعَادَ اللهُ عَزَّ وَجَلَّ કરબલા વાલી ઈફ્ફત મઆબ બીબિયોં رَضِيَ اللهُ تَعَالَى عَنْهُنَّ ને પદા તર્ક કિયા થા ? નહીં ઓર હરગિઝ નહીં તો ફિર મેહરબાની ફરમા કર અપની ના

इरमाने मुस्तफ़ा : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्इद पाक न पढा उस ने जन्नत का रास्ता छोड दिया. (फ़रान)

तुवानी पर तर्स आँधये और अपने कमजोर वुजूद को क़भ्र व जहन्नम के अजाब से बचाने की आतिर पर्दा ँप्तियार कीजिये. भुदा की कसम ! वोह बे पर्दगी छोटी मुसीबत नहीं हो सकती जो के अल्लाह عَزَّ وَجَلَّ के अजाब में इंसा कर रभ दे. وَالْمَيَادُ بِاللّٰهِ تَعَالٰى

31 म-दनी इलों का गुलदस्ता

❶ उमारे भीठे भीठे आका صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ औरत का हाथ, हाथ में लिये बिगैर इकत ज़बान से बैअत लेते थे.

(मुलज्जस अज बहारे शरीअत, जि. 3, स. 446)

मुरी-दनी पीर साहिब का हाथ नहीं यूम सकती

❷ औरत का अपने पीरो मुर्शिद से भी ँसी तरह पर्दा है जिस तरह दीगर ना मद्दरमों से. औरत अपने पीर का हाथ नहीं यूम सकती, अपने सर पर हाथ न इरवाअे, पीर साहिब के हाथ पाँउ भी न दाबे.

मर्द व औरत मुसा-इहा नहीं कर सकते

❸ मर्द व औरत आपस में हाथ नहीं मिला सकते. इरमाने मुस्तफ़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : “तुम में से किसी के सर में लोहे की कील ठोंक दी जाती ँस से बेहतर है के वोह किसी अैसी औरत को धूअे जो उस के लिये हलाल नहीं.” (مُعْجَم كَبِير ج ٢٠ ص ٢١١ حديث ٤٨٦)

❹ औरत अजन्बी मर्द के जिस्म के किसी भी हिस्से को न धूअे जब कि दोनों² में से कोई भी जवान हो उस को शह्वत हो सकती हो. अगर्ये ँस बात का दोनों² को ँत्मीनान हो के शह्वत पैदा नहीं होगी. (عالمگیری ج ٥ ص ٣٢٧, बहारे शरीअत, जि. 3, स. 443)

ફરમાને મુસ્તફા: ﷺ: عَلَى اللَّهِ تَعَالَى غَلِيظٌ عَلَيْهِ وَسَلَمٌ: મુઝ પર દુરુદે પાક કી કસરત કરો બેશક તુમ્હારા મુઝ પર દુરુદે પાક પઢના તુમ્હારે લિયે પાકીઝગી કા બાઈસ હૈ. (એબિલી)

મઠ્ઠ સે ચૂડિયાં પહનના

- ❶ ના મહરમ કે હાથ સે ઔરત કા ચૂડિયાં પહનના ગુનાહ હૈ. દોનોં² ગુનહગાર હૈં.

છોટે બચ્ચે કા કૌન સા હિસ્સા છુપાએ

- ❷ બહુત છોટે બચ્ચે કે લિયે ઔરત (યા'ની છુપાને કા ઉઝ્વ) નહીં ઇસ કે બદન કે કિસી હિસ્સે કો છુપાના ફર્જ નહીં, ફિર જબ કુછ બડા હો ગયા તો ઉસ કે આગે ઔર પીછે કા મકામ છુપાના ઝરૂરી હૈ. દસ¹⁰ બરસ સે બડા હો જાએ તો ઉસ કે લિયે બાલિગ કા સા હુકમ હૈ. (رَدُّ الْمُحْتَرَجِ ٩ ص ١٠٢), બહારે શરીઅત, જિ. ૩, સ. 442)

મહારિમ કે જિસ્મ કી તરફ દેખને કે અહકામ

- ❸ મઠ્ઠ અપની મહારિમ (યા'ની વોહ ખવાતીન જિન સે રિશ્તે કે લિહાઝ સે હમેશા કે લિયે નિકાહ હરામ હો મ-સલન વાલિદા, બહન, ખાલા, ફૂફી વગૈરા) કે સર, ચેહરા, કાન કન્ધા, બાઝૂ, કલાઈ, પિંડલી ઔર કદમ કી તરફ નઝર કર સકતા હૈ જબ કે દોનોં મેં સે કિસી કો શહ્વત કા અન્દેશા ન હો.

(મુલખ્ખસ અઝ બહારે શરીઅત, જિ. ૩, સ. 444, 445)

- ❹ મઠ્ઠ કે લિયે મહારિમ કે પેટ, કરવટ, પીઠ, રાન ઔર ઘુટને કી તરફ નઝર કરના જાઈઝ નહીં. (એઝન, સ. 445) (યેહ હુકમ ઉસ વક્ત હૈ જબ જિસ્મ કે ઇન હિસ્સોં પર કોઈ કપડા ન હો ઔર અગર યેહ તમામ આ'ઝા મોટે કપડે સે છુપે હુએ હોં તો વહાં નઝર કરને મેં હરજ નહીં)

- ❺ મહારિમ કે જિન આ'ઝા કો દેખના જાઈઝ હૈ ઉન કો છૂના ભી જાઈઝ હૈ જબ કે દોનોં મેં સે કિસી કો શહ્વત કા અન્દેશા ન હો.

(બહારે શરીઅત, જિ. ૩, સ. 445)

ફરમાને મુસ્તફા ﷺ : جس کے پاس مہرا لیک ڈો اور وہ لڈ مۇج ٲر دۇرڈ شરીف نہ ٲڈے تو وہ لڈ لوگوں مے سے کٲجوس تریٲن شٲس ہے. (مسند احمد)

માં કે ٲાઉં દબાના

- ﴿10﴾ મર્દ અٲની માં કે ٲાઉં દબા સકતા હૈ. મગર રાન ઉસ વક્ત દબા સકતા હૈ જબ કે કٲડે સે છુٲી હુઈ હો. માં કી રાન કો ભી બિલા હાઈલ ઘૂના જાઈઝ નહીં.

(મુલખ્મસ અઝ બહારે શરીઅત, જિ. 3, સ. 445)

માં કી કદમ બોસી કી ફઝીલત

- ﴿11﴾ વાલિદા કે કદમ કો બોસા ભી દે સકતા હૈ. હદીસે ٲાક મેં હૈ :
“જિસ ને અٲની માં કા ٲાઉ ચૂમા તો ઐસા હૈ જૈસે જન્નત કી ચૌખટ કો બોસા દિયા.”

(الْمَبْسُوطُ لِلْسَّرْحَسِيِّ ج ٥ ص ١٠٦)

ઈન રિશ્તેદારોં સે ٲર્દા હૈ

- ﴿12﴾ તાયાઝાદ, ચયાઝાદ, મામૂઝાદ, ફૂફીઝાદ, ખાલાઝાદ, સાલી ઔર બહનોઈ, ભાબી ઔર દેવર, જેઠ, ચચી, તાઈ, મુમાની, ખાલૂ, ફૂફા, લે ٲાલક બચ્યા જિસ કો અચ્યામે રઝાઅત¹ મેં દૂધ ન ٲિલાયા હો ઔર અબ મર્દ વ ઔરત કે મુઆ-મલાત સમઝને લગા હો મુંહ બોલે ભાઈ બહન, મુંહ બોલે માં બેટે, મુંહ બોલે બાٲ બેટી, ٲીર ઔર મુરી-દની અલ ગરઝ જિન કી આٲસ મેં શાદી જાઈઝ હૈ ઉન કા આٲસ મેં ٲર્દા હૈ. હાં ઐસી બુદિયા જો નિહાયત હી બદ શક્લ હો કે જિસ કો દેખને સે બિલ્કુલ શહ્વત કા શાઈબા ન હો ઉસ સે મર્દ કા ٲર્દા નહીં. ઈસ કે ઈલાવા કિસી ઔરત કો દેખને સે શહ્વત હો યા ન હો મર્દ બિલા ઈજાઝતે શર-ઈ નહીં દેખ સકતા. જિન સે હમેશા કે લિયે નિકાહ હરામ

1 : યાદ રહે ! બચ્ચે કો (હિજરી સન કે હિસાબ સે) દો સાલ કી ઉમ્મ તક દૂધ ٲિલાયા જાએ. ઈસ કે બા'દ દૂધ ٲિલાના જાઈઝ નહીં મગર ઢાઈ સાલ કી ઉમ્મ કે અન્દર અન્દર ઔરત અગર અٲના દૂધ ٲિલા દે તો હુરમતે નિકાહ સાબિત હો જાએગી યા'ની અબ યેહ રઝા-ઈ બેટા હૈ ઈસ સે ٲર્દા નહીં.

ફરમાને મુસ્તફા ﷺ : توم جذاً لمی هو موز पर दुइए पढे के तुम्हारा दुइए मोज तक पछोयता है. (طبرانی)

હે ઉન સે પદા નહીં. “બહારે શરીઅત” મેં હે કે ઔરત કો શહ્વત કા શુબા ભી હો તો અજનબી મર્દ કી તરફ હરગિઝ નઝર ન કરે. (બહારે શરીઅત, સ. 443)

સાસ સુસર સે પદા ?

- ﴿13﴾ હુરમતે મુસા-હરત કે સબબ મર્દ કો અપની સાસ સે ઔર ઔરત કો અપને સુસર સે પદે કે મુઆ-મલે મેં રિઆયત હાસિલ હો જાતી હૈ. હાં દોનોં મેં સે કોઈ એક અગર જવાન હૈ તો પદા કરના ચાહિયે યેહી મુનાસિબ હૈ. (હુરમતે મુસા-હરત કી તફ્સીલી મા'લૂમાત કે લિયે બહારે શરીઅત હિસ્સા 7 સે “મહૂરમાત કા બયાન” મુલા-હઝા ફરમા લીજિયે બલ્કે નિકાહ, તલાક, ઈદત, બન્ધોં કી પરવરિશ વગૈરા કે બારે મેં મા'લૂમાત હાસિલ કરને કે લિયે શાદી સે કબ્લ હી ઔર નહીં પઢા તો શાદી કે બા'દ હી સહી બહારે શરીઅત હિસ્સા 7 ઔર 8 ઝરૂર ઝરૂર પઢ લીજિયે.)

ઔરત કા ચેહરા ટેખના

- ﴿14﴾ ઔરત કા ચેહરા અગર્યે ઔરત નહીં મગર ફિતને કે ખોફ કે સબબ ગૈર મહરમ કે સામને મુંહ ખોલના મન્અ હૈ. ઈસી તરહ ઉસ કી તરફ નઝર કરના ગૈર મહરમ કે લિયે જાઈઝ નહીં ઔર ઘૂના તો ઔર ભી ઝિયાદા મન્અ હૈ.

(مُؤْتَفَتَحَاتُ ۲ ص ۹۷, બહારે શરીઅત, જિ. 1, સ. 484)

બારીક પાજામા મત પહનિયે

- ﴿15﴾ બા'ઝ લોગ બારીક કપડે કા પાજામા પહનતે હેં જિસ સે રાન કી જિલ્દ કા રંગ ચમક્તા હૈ, ઈસે પહન કર નમાઝ નહીં હોતી ઐસા પાજામા બિલા મક્સદે શર-ઈ પહનના હરામ હૈ.

करमाने मुस्तफ़ा: عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ: जो लोग अपनी मजलिस से अल्लाह के जिक्र और नबी पर दुरुद शरीफ़ पढ़े बिगैर उठ गये तो वोह बद्रुद्दार मुद्दार से उठे. (شعب الایمان)

दूसरे के ખુले હુએ ઘુટને દેખના ગુનાહ હે

- ﴿16﴾ બા'ઝ લોગ દૂસરોં કે સામને ઘુટને બલ્કે રાને ખોલે રહતે હું યેહ હરામ હૈ. (મુલખ્ખસ અઝ બહારે શરીઅત, જિ. 1, સ. 481) ઉન કી ખુલી હુઈ રાન યા ઘુટને કી તરફ નઝર કરના ભી જાઈઝ નહીં. લિહાઝા નીકર પહન કર ખેલને ઔર વરઝિશ કરને ઔર ઐસોં કો દેખને સે બચના ઝરૂરી હૈ.

તન્હાઈ મેં બે ઝરૂરત સત્ર ખોલના કેસા ?

- ﴿17﴾ સત્રે ઔરત હર હાલ મેં વાજિબ હૈ બિગૈર કિસી સહીહ વજહ કે તન્હાઈ મેં ખોલના ભી જાઈઝ નહીં લોગોં કે સામને ઔર નમાઝ મેં તો સત્ર બિલ ઈજમાઅ ફર્ઝ હૈ.

(رُؤُوسُ مَخْتَارٍ وَرُؤُوسُ الْمُخْتَارِ ٢٠٢ ص ٩٣), બહારે શરીઅત, જિ. 1, સ. 479 મુલખ્ખસન)

ઈસ્તિન્જા કે વક્ત સત્ર કબ ખોલે ?

- ﴿18﴾ ઈસ્તિન્જા કરતે વક્ત જબ ઝમીન સે કરીબ હો જાએં ઉસ વક્ત સત્ર ખોલના ચાહિયે ઔર ઝરૂરત સે ઝિયાદા હિસ્સા ન ખોલેં. (માખૂઝ અઝ બહારે શરીઅત, જિ. 1, સ. 409) અગર પાજામે મેં ઝિપ (zip) ડલવા લી જાએ તો પેશાબ કરને મેં બેહદ સહૂલત હો સકતી હૈ કે ઈસ તરહ બહુત કમ સત્ર ખોલને કી ઝરૂરત પડેગી. મગર પાની સે ઈસ્તિન્જા કરને મેં સખ્ત એહતિયાત કરની હોગી. ઝિપ બારીક વાલી સબ સે ઝિયાદા કામ્યાબ હૈ.

નાફ સે લે કર ઘુટને તક કા હિસ્સા

- ﴿19﴾ મર્દ દૂસરે મર્દ કે નાફ સે લે કર ઘુટને તક કા કોઈ હિસ્સા નહીં દેખ સકતા ઔર ઔરત ભી દૂસરી ઔરત કે નાફ સે ઘુટને તક કા કોઈ હિસ્સા નહીં દેખ સકતી. ઔરત ઔરત કે બાકી આ'ઝા

करमाने मुस्तफ़ा. عَلَى اللَّهِ تَعَالَى غَلِيظٌ وَعَلِيُّ بْنُ أَبِي رَاسِمٍ : जिस ने मुज पर रोज़े जुमुआ दौ सो बार दुरद पाक पढा उस के दौ सो साल के गुनाह मुआफ़ होंगे. (جمع الجوامع)

पर नज़र कर सकती है जब के शइवत का अन्हेशा न हो.

(अैज़न, जि. 3, स. 442, 443)

पर्टे के बाल दूसरों की नज़र से बयाईये

- ﴿20﴾ मूअे जेरे नाफ़ मूंड कर अैसी जगह ईंकना दुरुस्त नहीं जहां दूसरों की नज़र पड़े. (बहारे शरीअत, जि. 3, स. 449)

औरत की कंधी के बाल

- ﴿21﴾ औरतों के लिये लाज़िम है के कंधा करने या सर धोने में जो बाल निकलें उन्हें कहीं छुपा दें के गैर मर्ट की उन पर नज़र न पड़े. (अैज़न, स. 449)

- ﴿22﴾ डेज का लत्ता अैसी जगह हरगिज़ न ईकें जहां दूसरों की नज़र पड़े.

औरत के पाँउं की जंज़न की आवाज़

- ﴿23﴾ उदीस शरीफ़ में है : “अद्लाह عَزَّ وَجَلَّ उस कौम की दुआ नहीं कबूल इरमाता जिन की औरतें जंज़न पढनती हों.” (التفسيرات الاحمدية، ص ०१०) उदीसे पाक में जिस बाजेदार जंज़न पढनने की मुमा-न-अत की गई उस से मुराद धुंगरु वाला जेवर है. ईस से समजना याडिये के जब जेवर की आवाज़ अ-दमे कबूले दुआ (या'नी दुआ कबूल न होंने) का सभभ है तो भास औरत की (अपनी) आवाज़ (का बिला ईज्जते शर-ई गैर मर्टों तक पडोंयना) और उस की बे पर्टगी कैसी मूजिबे गजबे ईलाही होगी, पर्टे की तरफ़ से बे परवाई तबाही का सभभ है. आ'ला उज़रत رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ बजने वाले जेवर के ईस्ति'माल के मु-तअद्लिक इरमाते हैं : बजने वाला जेवर औरत के लिये ईस डालत में ज़ाईज है के ना महरमों म-सलन ज़ाला मामूं

करमाने मुस्तफ़ा صلى الله تعالى عليه و آله وسلم : मुज पर दुइरुद शरीफ़ पढो अद्लाह उजुल तुम पर रहमत भेजेगा. (अिन सरी)

यया झूझी के बेटों, जेठ, देवर, अहनोई के सामने न आती हो न उस के जेवर की जन्कार (या'नी अजने की आवाज) ना महरम तक पड़ोये. अद्लाह उजुल इरमाता है :

..... وَلَا يُبْدِينَ زِينَتَهُنَّ إِلَّا لِبُعُولَتِهِنَّ (तर-ज-मअे कन्जुल
 धिमान : और अपना सिंगार अाहिर न करें मगर अपने शोहरों
 पर... (अ. ११८, अल-नूर: ३१) और इरमाता है :

وَلَا يَصْرِبْنَ بِأَرْجُلِهِنَّ لِيُعْلَمَ مَا يُخْفِينَ مِنْ زِينَتِهِنَّ (तर-ज-मअे
 कन्जुल धिमान : जमीन पर पाउं जोर से न रभें के जाना जअे उन का धुपा
 हुवा सिंगार) (अ. ११८, अल-नूर: ३१) इअेदः येह आयते करीमा जिस तरह
 ना महरम को गहने (या'नी जेवर) की आवाज पड़ोयना मन्अ
 इरमाती है यूंही जअ आवाज न पड़ोये (तो) उस का पहनना
 औरतों के लिये जअज अताती है के धमक कर पाउं रभने को
 मन्अ इरमाया न के पहनने को. (इतावा र-अविय्या, जि. 22, स.
 128 मुलअ्भसन) धस से वोह धस्लामी अहनें दसें धअत हासिल
 करें जो अरीदारी, महल्ला दारी वगैरा में गैर मर्दों से बे तकल्लुफी
 के साथ गुइत-गू करती हैं. उन्हें तो घर की यार दीवारी में ली
 आहिसता आवाज निकालनी याहिये ताके दरवाजे के आहर
 वाले लोग या पडोसी वगैरा आवाज न सुनने पाअें. अय्यों पर
 ली गरजते अरसते वक्त येही अेहतियात रभें.

औरत पूरी आस्तीन का कुरता पहने

﴿24﴾ औरत पर्दे से हाथ अढा कर गैर मर्द को धस तरह कोई यीज न
 दे के उस की कलाई (हथेली और कोहनी के दरमियान का हिससा
 कलाई कहलाता है) नंगी हो. (आज कल उभूमन अैसा ही होता है.

करमाने मुस्तफ़ा عَنِ اللَّهِ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ : मुज़ पर कसरत से दुरुद पाक पढो बेशक तुम्हारा मुज़ पर दुरुद पाक पढना तुम्हारे गुनाहों के लिये मङ्क़िरत है. (ابن عساکر)

अगर मर्द ने कस्दन कलाई की तरफ़ नज़र की तो वोह भी गुनाहगार है. लिहाज़ा जैसे भौकअ पर कलाई किसी मोटे कपडे से छुपाना ज़रूरी है) इस्लामी बहनों पूरी आस्तीन का कुरता पहनें नीज़ हस्ताने और जुराबें भी इस्ति'माल इरमाओं.

शर-ई पर्दे वाली को देखना कैसा ?

﴿25﴾ बयान कर्दा शर-ई पर्दे में मल्बूस फ़ातून को अगर मर्द बिला शह्वत देखे तो मुज़ा-यका नहीं के यहाँ औरत को देखना नहीं हुवा बल्के येह उन कपडों को देखना हुवा. हां अगर युस्त कपडे पहने हां के बदन का नकशा भिंय ज़ता हो म-सलन युस्त पाजामे में पिंडली और रान वगैरा की हैअत नज़र आती हो तो इस सूरत में नज़र करना ज़र्हज़ नहीं.

(मुलम्भस अज़ बहारे शरीअत, जि. 3, स. 448)

औरत के बालों को देखना हराम है

﴿26﴾ अगर औरत ने किसी बारीक कपडे का हुपट्टा पहना है जिस से बाल या बालों की सियाही कान या गरदन नज़र आती हो तो उस की तरफ़ नज़र करना हराम है. (औज़न) इस तरह के बारीक हुपट्टे में औरत की नमाज़ भी नहीं होती.

﴿27﴾ आज कल كَلْبَاتُ اللَّهِ كَلْبَاتُ اللَّهِ औरतें फुले बालों के साथ बाहर निकलतीं कलाईयां और बाल फोले गाडियां चलातीं और स्कूटर के पीछे अपनी चुटिया लहराती हुई बैठती हैं. उन के बालों या कलाईयों पर अयानक पहली नज़र मुआफ़ है. जब के इरन इर ली और कस्दन उस तरफ़ देखना या नज़र न उटाना हराम है.

करमाने मुस्तफ़ा: عَلَى اللَّهِ تَعَالَى غَيْرُ الْوَسْمِ : जिस ने किताब में मुज पर दुइडे पाक लिखा तो जब तक मेरा नाम उस में रहेगा फिरिश्ते उस के लिये ईस्तिफ़ार (या'नी बप्शिश की दूआ) करते रहेंगे. (पं. ५)

डिकायत

मुफ़्तिये दा'वते ईस्लामी हज़रते अल्लामा मुफ़्ती मुहम्मद फ़ाज़्क अत्तारी عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْبَارِي ने इस भौंक से अपनी स्कूटर बेच डाली के रास्ते में बे पर्दा औरतें ब कसरत होती हैं, ड्राईविंग में निगाहों की डिफ़ाजत मुम्किन नहीं क्यूंके न देभे तो हादिसे का भतरा और देभना तो गवारा नहीं. अल्हाड وَعَرَّوْجْ की उन पर रडमत हो और उन के सटके हमारी बे हिसाब मग़िरत हो.

﴿28﴾ मर्द अज्नबिय्या औरत के किसी भी हिस्से को बिला ईजाजते शर-ई न देभे.

मर्द से औरत कब ईलाज करवा सकती है ?

﴿29﴾ अगर कोई तबीबा न मिले तो ब अम्ने मजबूरी औरत तबीब को हस्बे ज़रूरत अपने जिस्म का बीमारी वाला हिस्सा दिभा सकती है और अब तबीब ज़रूरतन धू भी सकता है. ज़रूरत से ज़ियादा जिस्म हरगिज़ न षोले.

गैर औरत के साथ तन्हाई

﴿30﴾ गैर मर्द और गैर औरत का अेक मकान में तन्हा होना हराम है. हां ऐसी बद्द सूरत बुढिया के जो शइवत के काबिल न हो उस को देभना और उस के साथ तन्हाई जाईज है.

अम्रद के साथ तन्हाई

﴿31﴾ मर्द का “अम्रद” को शइवत की नज़र से देभना हराम है. शइवत आती हो तो उस के साथ अेक मकान में तन्हाई ना जाईज है. षोसा लेने या थिपटा लेने की प्वाहिश पैदा होना

کرماتے مستکفہ صلی اللہ تعالیٰ علیہ و آلہ وسلم: جیٰ موز پر اےک دین مے 50 بار دُرُودِ پاک پڌے کِیامات ک دین مے اسی سے موسا-کڈا کڑے(یا'نی لاث مِیلائی)گا. (ابن بشکوال)

شڈِوت کی الامات مے سے ہے.¹

تہمیڈ : مالمی، مژدُر، یوکیدار، ڈاڈِور اور دَر کے مولاژیم سے ہمی بے پڌِگی ہرام ہے.

(پڌے کی تفسیلی مالمی'لوماٹ لاسیل کرنے کے لیکے مک-ت-ہتول مہی'نا کی مہلوما کیتاہ "پڌے کے ہارے مے سواہل جواہل" پڌ لیکجیے.)

یہ ریسالہ پڌ کر دُورے کو دے دیجیے

شاہی گہمی کی تکرہبات، ہجرتیماآت، آماراس اور جہلوسے مہلاہ وگہرا مے مک-ت-ہتول مہی'نا کے شامہ کڈا رساڈل اور م-ہنی کُلوں پر مشتمل پمفلٹ تکرہم کر کے سواہل کماڈیے، گاڈکوں کو ہل نیہتے سواہل توڈکے مے دےنے کے لیکے اپنی ڈکانوں پر ہمی رساڈل رہنے کا مالمی'مہل ہناڈیے، اہہار کُروشوں یا ہہمیں کے جریہے اپنے مہلے کے دَر دَر مے مالاہنا کم اڈ کم اےک اڈھ سونٹوں ہرا ریسالہ یا م-ہنی کُلوں کا پمفلٹ پڈایا کر نہکی کی دالمی'ت کی ڈمے مہی'ڈیے اور ہل سواہل کماڈیے.

گمے مہی'نا، ہکیا، مہکیرت اور بے لیساہل جننتول کیردوس مے آکا کے پڈوس کا تالیہل
7 جہل لیکجہ 1434 س.ل.د.
13-10-2013



آڈوراج

مطبوعہ	کتاب	مطبوعہ	کتاب
دارالمعرفہ بیروت	الزواج من اقران الکبار	مکتبہ المدینہ باب المدینہ کراچی	قرآن مجید
دارالکتب العلمیہ بیروت	المہو ط	پشاور	تفسیر استاحمدیہ
دارالمعرفہ بیروت	رد البحر	دارالمنہج بیروت	مسلم
دارالفکر بیروت	عالمگیری	داراحیاء التراث العربی بیروت	ابوداؤد
رضا فاؤنڈیشن مرکز الاولیاء لاہور	فتاویٰ رضویہ	دارالفکر بیروت	ترمذی
مکتبہ المدینہ باب المدینہ کراچی	بہار شریعت	داراحیاء التراث العربی بیروت	مجموعہ کبیر
شیاء القرآن ٹیلی کیشنز مرکز الاولیاء لاہور	مراۃ المناجیح	دارالکتب العلمیہ بیروت	الفردوس ہما ثورا خطاب
☆☆☆	☆☆☆	دارالکتب العلمیہ بیروت	تاریخ بغداد

مدینہ

1 : مہی'نا مالمی'لوماٹ کے لیکے مک-ت-ہتول مہی'نا کا مہلوما ریسالہ "کومے لوت کی تہالہ کاریاں" (45 سڈلٹ) پڌ لیکجیے .

﴿كِرْمَانِ مُسْتَفِي﴾ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ: બરોડે કિયામત લાગો મેં સે મેરે કરીબ તર વોહ હોગા જિસ ને દુન્યા મેં મુજ પર કિયાદા દુરુદે પાક પઢે હોંગે. (ترمذی)

ફેહરિસ

ઉન્વાન	સંક્ર્ષ્	ઉન્વાન	સંક્ર્ષ્
દુરુદ શરીફ કી ફઝીલત	1	માં કી કદમ બોસી કી ફઝીલત	11
ઔરત ખુશબૂ લગા કર બાહર ન નિકલે	2	ઈન રિશ્તેદારોં સે પર્દા હૈ	11
બે પર્દગી કી હોલનાક સઝા	3	સાસ સુસર સે પર્દા ?	12
ખોફનાક જાનવર	3	ઔરત કા ચેહરા દેખના	12
કમઝોર બહાને	4	બારીક પાજામા મત પહનિયે	12
પચાસ સાઠ સાંપ	5	દૂસરે કે ખુલે હુએ ઘુટને દેખના ગુનાહ હૈ	13
ખોફનાક ગઢા	6	તન્હાઈ મેં બે ઝરૂરત સત્ર ખોલના કેસા ?	13
ખબરદાર !	7	ઈસ્તિન્જા કે વક્ત સત્ર કબ ખોલે ?	13
બેટા ગયા તો ક્યા હુવા, હયા તો બાકી હૈ	8	નાફ સે લે કર ઘુટને તક કા હિસ્સા	13
બે પર્દગી કોઈ છોટી મુસીબત નહીં !	8	પર્દે કે બાલ દૂસરોં કી નઝર સે બચાઈયે	14
31 મ-દની ફૂલોં કા ગુલદસ્તા	9	ઔરત કી કંઘી કે બાલ	14
મુરી-દની પીર સાહિબ કા હાથ નહીં		ઔરત કે પાઉં કી ઝાંઝન કી આવાઝ	14
ચૂમ સક્તી	9	ઔરત પૂરી આસ્તીન કા કુરતા પહને	15
મર્દ વ ઔરત મુસા-ફહા નહીં કર સક્તે	9	શર-ઈ પર્દે વાલી કો દેખના કેસા ?	16
મર્દ સે ચૂડિયાં પહનના	10	ઔરત કે બાલોં કો દેખના હરામ હૈ	16
છોટે બચ્ચે કા કૌન સા હિસ્સા છુપાએ	10	હિકાયત	17
મહારિમ કે જિસ્મ કી તરફ દેખને		મર્દ સે ઔરત કબ ઈલાજ કરવા સક્તી હૈ ?	17
કે અહકામ	10	ગૈર ઔરત કે સાથ તન્હાઈ	17
માં કે પાઉં દબાના	11	અમ્રદ કે સાથ તન્હાઈ	17

ذمى الله تعالى فيها فكرمانه جیجی فائیمہ

હજરતે સચ્ચિદુના અલિય્યુલ મુર્તજા શેરે ખુદા
 ذمى الله تعالى فيها نے હજરતે ફાતિમા رضی الله تعالى عنها سے
 પૂછા : ઔરતોં કે હક મેં સબ સે બેહતર કયા હે ? અઝ
 કી : ન વોહ કિસી ના મહરમ શખ્સ કો દેખેં ઔર ન
 કોઈ ના મહરમ ઉન્હેં દેખેં . (حلیة الأولیاء ج ۲ ص ۱۵۱ تلخیصاً)



મક-ત-બતુલ મદીના

દા'વતે ઈસ્લામી

સિલ્વેકેડ હાઉસ, અવિક કી મસ્જિદ ડે સામને, તીન દરવાજા, અહમદાબાદ-1 ગુજરાત, ઈન્ડિયા
 Mo.091 93271 68200 E-mail : maktabaahmedabad@gmail.com www.dawateislami.net